

પ્રકરણ-૮
(નિયમ સંગ્રહ-૮)

નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યપદ્ધતિ :

| ક્રમ | જેના પર નિર્ણય લેવાના છે તે વિષય | માર્ગદર્શક, સુચન, દિશા નિર્દેશ જો હોય તો | અમલની પ્રક્રિયા | નિર્ણય લેવાની કાર્યવાહીમાં સંકળાયેલ અધિકારીઓ ના હોદા | અધિકારી ઓના સંપર્ક અંગેની માહિતિ | જો નિર્ણયથી સંતોષ ન હોય તો ક્યાં અને કેવી રીતે અભીલ કરવી |
|------|----------------------------------|--|---|--|---|---|
| ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ |
| ૧ | વહીવટી | સબંધિત નીતિ અને નિયમોની જોગવાઈઓ પ્રમાણે | પ્રત્યેક બાબતે નોંધ રજુ કરી સક્ષમ સત્તાધિકારી ની તેમજ જ્યાં જરૂર હોય ત્યાં બોર્ડ/સરકારશ્રીની મંજુરી મેળવવામાં આવે છે. | મેનેજરશ્રી (વહીવટ), જનરલ મેનેજરશ્રી તથા મેનેજીગ ડિરેક્ટરશ્રી | નિયમ સંગ્રહ-૮ માં આપેલ ડિરેક્ટરી પરથી જાણી શકાય છે. | નિયમ સંગ્રહ-૭ મુજબ એપેલેટ અધિકારીનો સંપર્ક કરવાનો રહે છે. |
| ૨ | નાણાંકીય | સબંધિત નીતિ અને નિયમોની જોગવાઈઓ પ્રમાણે | પ્રત્યેક બાબતે નોંધ રજુ કરી સક્ષમ સત્તાધિકારી ની તેમજ જ્યાં જરૂર હોય ત્યાં બોર્ડ/સરકારશ્રીની મંજુરી મેળવવામાં આવે છે. | મેનેજરશ્રી (નાણાં), મુખ્ય ડિસાબી અધિકારીશ્રી તથા મેનેજીગ ડિરેક્ટરશ્રી | નિયમ સંગ્રહ-૮ માં આપેલ ડિરેક્ટરી પરથી જાણી શકાય છે. | નિયમ સંગ્રહ-૭ મુજબ એપેલેટ અધિકારીનો સંપર્ક કરવાનો રહે છે. |
| ૩ | યોજનાકીય | સબંધિત નીતિ અને નિયમોની જોગવાઈઓ પ્રમાણે | પ્રત્યેક બાબતે નોંધ રજુ કરી સક્ષમ સત્તાધિકારી ની તેમજ જ્યાં જરૂર હોય ત્યાં બોર્ડ/સરકારશ્રીની મંજુરી મેળવવામાં આવે છે. | મેનેજરશ્રી (યોજના), જનરલ મેનેજરશ્રી તથા મેનેજીગ ડિરેક્ટરશ્રી | નિયમ સંગ્રહ-૮ માં આપેલ ડિરેક્ટરી પરથી જાણી શકાય છે. | નિયમ સંગ્રહ-૭ મુજબ એપેલેટ અધિકારીનો સંપર્ક કરવાનો રહે છે. |
| ૪ | વસુલાત | સબંધિત નીતિ અને નિયમોની જોગવાઈઓ પ્રમાણે | પ્રત્યેક બાબતે નોંધ રજુ કરી સક્ષમ સત્તાધિકારી ની તેમજ જ્યાં જરૂર હોય ત્યાં બોર્ડ/સરકારશ્રીની મંજુરી મેળવવામાં આવે છે. | મેનેજરશ્રી (વસુલાત), મુખ્ય ડિસાબી અધિકારીશ્રી તથા મેનેજીગ ડિરેક્ટરશ્રી | નિયમ સંગ્રહ-૮ માં આપેલ ડિરેક્ટરી પરથી જાણી શકાય છે. | નિયમ સંગ્રહ-૭ મુજબ એપેલેટ અધિકારીનો સંપર્ક કરવાનો રહે છે. |